

## ‘નૈનદર્શિન’ અનુવાદ ગ્રંથનો પરિચય

નગીન લી. શાહ

પંડિત બેચરદાસજીએ દર્શનતથાસ્ત્રમાં પણ અમૃત્ય કરી આપ્યો છે. તેમણે અને પંડિત સુખલાલજીએ સાથે મળી સિદ્ધસેનતા સન્મતિતર્ક્ષ્રીપ્રકારણુની વિસ્તૃત અને સર્વવાદસમુચ્ચયરૂપ અલય-હેવસ્તુરિની ટીકાનું સંપાદન કર્યું છે. દર્શનક્ષેત્રમાં આ એક બહુમુલ્ય ડામ થયું. વળી, આજથી પચાસ વર્ષે પહેલાં તેમણે આચાર્ય હરિભદ્રસુરિના ષડુર્ધનસમુચ્ચયય ઉપરની ગુણુરત્નતી ટીકાના જૈન ભાગનો ગુજરાતી અનુવાદ કર્યો. આ તેમનું દર્શનક્ષેત્રમાં ભીજું મહત્વતું કાર્ય છે. જે કે પંડિતજીના રસના વિષયો ખાસ તો વ્યાકરણ-ભાષાશાસ્ત્ર અને આચારમીમાંસા રહ્યા હતા તેમ જ્તાં તેમણે દર્શનના ક્ષેત્રમાં જે કંઈ પ્રદાન કર્યું છે તે પણ ધણું મોઢું છે. આપણે તેમણે કરેલ આ અનુવાદની વિચારણા કરીશું.

પંડિતજીએ આ અનુવાદ સાથે માહિતીપૂર્ણ અને વિચારપ્રેરક ૧૨૦ પૃષ્ઠની વિસ્તૃત પ્રસ્તાવના જેડી છે. તેમાં શ્રી હરિભદ્રનાં જીવન અને ઇતિહાસની વિશે તેમ જ ગુણુરત્ન નિશે ઐતિહાસિક દસ્તિબિલી વિગતો આપી શકાય તેટલી વિગતો આપી છે. પંડિતજીને શુદ્ધ તર્ક અને વાદો પસંદ ન હતા. તેમની દસ્તિ સાધય જીવનને શુદ્ધ કરતા તત્ત્વથી આકર્ષાતી. તેમને સમન્વય પ્રિય હતો. આ પ્રસ્તાવનામાં પંડિતજીએ કરેલો દર્શનોને સમન્વય ચિત્તાકર્ષક અને સરવેદ્રેકી છે.

હરિભદ્રને અનુસરી તેઓ પણ કપિલ, સુગત, જિન સૈને આપી ગણે છે. તેમના જિપદેશનો બેદ તો આત્માચીની કલ્પાચીના બેદને કારણે છે એમ તેઓ સમજે છે. તેઓ માને છે કે વાદ-પ્રતિવાદ છાડી તેમના ઉપદેશનું હાર્દ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આ હાર્દ તેઓ આ રીતે સમજાવે છે : “ઈશ્વરવાદને વળગનારો સુમુખુ પોતાની ડોઈ પણ પ્રતિતિમાં કર્તાપણુની ભાવના એટલે ‘હું કરું છુ’ ‘મારો જેવો કરનાર ડોણું છે’ એવી વૃત્તિ રાખી શકે જ નહિ. અને મન તો કર્તા, હર્તા, પાલચિતા ઈશ્વર જ છે. એણે તો પોતાનું સર્વસ્વ શ્રી ઈશને ચરણે ધરેલું હોવું જોઈએ. પોતાનો એકનો એક જોટનો દીકરો, પોતાની અતુલ સંપત્તિ કે ભીજું હોઈ પોતાની પ્રિય વસ્તુનો નાશ થતાં પણ એને શોક ન હોઈ શકે.....અદૈતવાદના ખરા અનુયાયીને ‘મારું તારું’ હોઈ શકતું નથી, એ તો સર્વત્ર સમ જ હોઈ શકે છે—શત્રુની ભિત્ર એને ધરે જ શી રીતે ?..... બધા જીવાનું અદૈત હોઈ એ કચાંય રાગ કે રાષ શી રીતે કરી શકે ?.....ક્ષણિકવાદનો પાડો ભક્ત પોતાના ફેને સ્થિર શી રીતે માને ? તે થુંકની છોળો ઉડાડી ક્ષણિકવાદ સાચિત ન કરે, એ તો એ વાદને પોતાના જીવનમાં ઉતારીને જ સંસારની ક્ષણિકવાદને વગર બોલ્યે સમજાવી હો. કર્મવાદનો ઉદ્દેશ સંસારની વિચિત્રતા જાણુવી આત્મામાં સ્થિરતા આણુવાનો છે, નહિ કે ભીજી ભીજાની આત્માન્ધીયાને તપાસ્યા કરવાનો તેમ ઈશ્વરવાદીયાના ઈશ્વરને દૂષિત કરવાને પણ કર્મવાદને આગળ રવાનો નથી.”

૪ એ છ દર્શનોને તેમનું પ્રયોગ કરે, તેમનો જીવનમાં ઉપયોગ છે એ દર્શાવિતાં પંડિતજી આત્મધનજીના શ્રી નમિનાથસ્તવનનો વારંવાર ડવાદો આપે છે. ચાર્ચાકર્ષિન વિશે પંડિતજી લખે છે કે : “વિચાર કરતાં એટલું તો જરૂર જૂઝે છે કે નીતિપ્રધાન અને ધર્મપરાચાણ આ આર્થ દેશમાં પ્રાદુર્ભૂત થયેલો આ મત હિસાતું, જુડાણાતું, ચોરીતું, વ્યલિયારનું

અને 'કૃત્તણ કૃત્વા ધૃત્તં પિવેત્' જ સમર્थીન કરી જીવનવિકાસનો માર્ગ જતાવતો હોય એમ ભારા તો ભાનવામાં આવતું નથી.... પરમયોગી આનંદધનજી ભડારાજ આ ભત વિશે જલ્લાવતાં કહે છે કે— 'લોકાયતિક ઝૂપ જિનવરની, અંશવિચાર જો ક્ષાને.'

પ્રસ્તાવનામાં તેમણે અર્થસભાર અને નવી દિશા ખોલનારાં ટિપ્પણો લખ્યા છે. તેનાં એકે ઉદ્ઘારણો લઈશું. પુ. ૬૩ ઉપર 'ઓદ્ધધમ' અને યુદ્ધ ઉપર વિસ્તૃત ટિપ્પણું છે તેનો અંશમાત્ર આપું છું. તેચો લખે છે : "આ ભડાપુરુષ (યુદ્ધ) આત્મવાદી છે, તો પણ તેમની પણીના તેમના કેટલાક અનુયાયી-ઓની તર્કજગતને લીધે તેમના ઉપર 'અનાત્મવાદી' તરીકેનો જે આરોપ આજ ધરણ વખતથી મુક્તવામાં આવે છે તે અવિવેકથી થયેલો છે અને ખોટો છે." પુ. ૭૫ ઉપર 'તન્માત્રા' શબ્દ ઉપર આ પ્રમાણે ટિપ્પણું છે : "પરમાણુ" શબ્દનો ભાવ 'તન્માત્રા' શબ્દથી સૂચની શકાય છે. નૈતનક્ષત્રિનમાં 'પરમાણુ' શબ્દ ઉપરાત એક એવા જ ભાવનાંનો 'વર્ગાણુ' શબ્દને પણ આવે છે. 'પ્રહેઠ' શબ્દને પણ 'પરમાણુ'ના અર્થમાં નૈતલાષામાં વાપરવામાં આવે છે પણ તે, અવિલક્ત પરમાણુને એટલે કે કોઈ જથ્થામાં રહેલા પરમાણુને જ સૂચને છે અથર્ત્વ નૈતલાષામાં એકલા ધૂટા પરમાણુને 'પ્રહેઠ' શબ્દથી સૂચની શકાય નહિં." પ્રસ્તાવનામાં આવાં ટિપ્પણો લગભગ એક સો જેટલાં છે. આ ટિપ્પણોમાં પંડિતજીની ઐતિહાસિક, હુલનાત્મક અને નિષ્પક્ષ દસ્તિ આપણું ધ્યાન ચેંચે છે.

હું તેમના અનુવાહી લાક્ષણ્યિકતા તપાસીએ. તેના માટે એક ઈશ્વરવિષયક કંડિકા પસંદ કરીએ. તે નીચે પ્રમાણે છે :

કિઞ્ચ ઈશ્વરાય જગન્નિર્માળે યથારુચિપ્રવૃત્તિઃ, કર્મપારતન્દ્યેણ, કરુણયા, કીડયા, નિપ્રહાનુપ્રહ-વિધાનાર્થ સ્વભાવતો વા। અત્રાદ્યવિકલ્પે કદાચિદન્યાહદ્યેવ સુષ્ઠિ: સ્યાત् । દ્વિતીયે સ્વાતન્ત્ર્યહાનિઃ । તૃતીયે સર્વમપિ જગત્ સુખિતમેવ કુર્યાત् । અથ ઈશ્વર: કિં કરોતિ પૂર્વીજીતૈરેવ કર્મભિર્વશીકૃતા દુઃખમનુભવન્તિ? તદા તસ્ય કઃ પુરુષકારઃ? અદૃષ્ટાપેશ્વર્ય ચ કર્તૃત્વે કિં તત્કલ્પનયા, જગતસ્તદ્ધીનતૈવાસ્તુ (શાનપીઠ ભૂતીદ્વારી નૈતન અન્યમાલા, સંસ્કૃત અન્યાંક ૩૬, ૧૬૭, પુ. ૧૮૨-૧૮૩)

હું અનુવાદ વાંચીએ.

અનીશ્વરવાદી : વળી, અમે આ એક બીજું પૂર્ણાંદ્રે છીએ કે, તમેએ માનેનો ઈશ્વર, જગતને રચવાની ને લાંબાગડ કરી રહ્યો છે, શું તેમાં તે પોતાની મરજી પ્રમાણે પ્રગતિ કરે છે? વા કર્મને વશ થઈને પ્રવૃત્તિ કરે છે? વા હ્યાને લીધે પ્રવૃત્તિ કરે છે? વા લીલા કરવાની વૃત્તિથી પ્રવૃત્તિ કરે છે? વા ભક્તોને તારવા અને હુણેને ભારવા પ્રવૃત્તિ કરે છે કે એ જતની પ્રવૃત્તિ કરવાનો એનો સ્વભાવ જ છે?

ઈશ્વરવાદી : ભાઈ, એ (ઈશ્વર) તો સૌનો ઉપરી હોવાથી જગતની રચના કરવામાં એની પોતાની જ મરજી પ્રમાણે વર્તે છે અને જગત પણ એ પ્રમાણે જ ચાલ્યા કરે છે.

અનીશ્વરવાદી : ભાઈ! અમને તો એમ જણાતું નથી. જે ઈશ્વર જગતને ભનાવવામાં પોતાની જ મરજી પ્રમાણે વર્તતો હોય તો કોઈ એવો સમય પણ આવવેલો નેછાંએ કે, જે સમયે જગત તદ્દન જુદા પ્રકારનું પણ રચાયું હોત-હોય. આપણાથી એ તો ન જ કલ્પી શકાય કે, તેની મરજી ઉમેશા એકની એક જ રહે છે. કારણ કે, તે પોતે તદ્દન સ્વતંત્ર હોવાથી ધારે તેવું કરી શકે છે. પરંતુ જગત તો હુમેશા એક જ ધારે ચાલ્યું જય છે અને ચાલ્યું આવે છે. એની બીજી કોઈ જતની રચના કઢી, કોઈએ અને કચારેય સાંભળી કે જાણી પણ નથી. તેથી એમ જાણી શકાય છે કે, જગતની રચના કરવામાં ઈશ્વર પોતાની જ મરજી પ્રમાણે વર્તતો નથી.

**ઈશ્વરવાદી:** ભાઈ, ઈશ્વર તો કર્મને વશ રહીને જગતની રચના કરી રહ્યો છે. એથી એ ડાઈ જતની નહિ બનવા જેવી રચના કરી શકે જ નહિ.

**અનીશ્વરવાદી:** થયું. જે ઈશ્વર પણ કર્મને વશ રહેતો હોય તો એ ઈશ્વર શાનો? સર્વ શક્તિવાળો પ્રભુ શાનો?

**ઈશ્વરવાદી:** ભાઈ, જરા જૂલ થઈ ગઈ, ખરું તો એ છે કે ફક્ત દ્વારે લીધે જ ઈશ્વર જગતને રચવાની ભાંજગડ કરી રહ્યો છે—કારણું કે, એ તો મહાદ્વારાનું છે.

**અનીશ્વરવાદી:** જે ઈશ્વર દ્વારે લીધે જ જગતને બનાવી રહ્યો હોય તો એ આખા જગતને સુખી શામાટે ન કરે? ગુવમાત્રને સુખ આપવું એ દ્વારા પુરુષનું કામ છે. પરંતુ જગતમાં સુખ તો સરસવ જેટલું અને દુઃખ કુંગર જેટલું જણાય છે. એથી આવા જગતને જેઠને ડાઈ પણ એમ તો ન જ કેદ્વી શકે કે, ઈશ્વર ફક્ત દ્વારાની લાગણીથી જ આને (જગતને) બનાવી રહ્યો છે.

**ઈશ્વરવાદી:** જે કે, ઈશ્વર તો દ્વારાનું હોવાથી બધાને સુખી જ સરજે છે, પરંતુ એ બધા જીવો પોતપોતાનાં કર્મને લીધે પાછા દુઃખી થાય છે એમાં ઈશ્વર શું કરે?

**અનીશ્વરવાદી:** થયું. આ તો તમારા જ કહેવા પ્રમાણે ઈશ્વર કરતાં પણ કર્માનું બળ વહુ જણાય છે. ત્યારે ભાઈ, હવે ઈશ્વરને જવા દઈને જે એને ડેકાણે કર્મને માનો તો વાધો છે?

પંડિતજીનો આ અનુવાહાંશ વાંચ્યા-સાંક્ષણ્યા પછી સૌંને પ્રતીતિ થશે કે પંડિતજી દર્શનના કઠણું વાઢને પણ ગુજરાતીમાં સરળ અને સહજ રીતે ઉતારે છે. તેમના અનુવાદમાં તરજુભિયાપણું નથી. ગુજરાતી ભાષામાં અનુવાદ કરતી વખતે તે ભાષાની પોતાની જે લઢણો છે તેમને તે અનુસરે છે. સંસ્કૃત ભાષાની લઢણો ગુજરાતીમાં જેમની તેમ લાવવાથી અનુવાદ કર્યાનું થની જય છે. સંસ્કૃતમાં કર્માનુષ્યપ્રોગ સારો લાગે છે પરંતુ તેનો ગુજરાતી અનુવાદ કરતાં જે તે પ્રોગ બદલી કર્તારી ન કરવામાં આવે તો અનુવાદમાં અસ્વાલાવિકતા અને કિંબંધતા પ્રવેશે છે. બીજું, સંસ્કૃત ભાષામાં અત્યંત લાઘવ છે. ધણી અધી વાત દૂંકમાં કહી શકાય છે. તેથી જ્યારે સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ પંડિતજી કરે છે ત્યારે ગુજરાતી ભાષાના સ્વભાવ પ્રમાણે જરૂરી વિસ્તાર પણ તે કરે છે. વળી, પૂર્વપક્ષ-ઉત્તરપક્ષનો તરત જ જ્યાલ આવે એ આશયથી પંડિતજીએ અનુવાદમાં સંવાદશીલી અપનાવી છે. પંડિતજીએ અનુવાદમાં જ્યાં તક ભળી ત્યાં મૂળના અર્થને અનુસરતા ગુજરાતી પદોને દાખલ કરી અનુવાદને રોચક કર્યો છે. દેહ અને આત્માને એક માનતા ચાર્ચાકું મૂળમાં જ્યાં ખંડન છે ત્યાં અનુવાદમાં તેમને નીચેનું પદ મૂકવાની જે તક ભળી તેનો તેમણે સરસ ઉપ્યોગ કર્યો છે. તે પદ છે—

પરમયુદ્ધ કૃશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અદ્ય,  
દેહ હોય જે આત્મા ધટે ન આમ વિકલ્ય.

એમણે કરેલ આ અનુવાદ જૈનદર્શન વિશે અભ્યાસીને સારી માહિતી આપે છે અને બધા જ મહત્વના સિદ્ધાન્તોની વિશદ ચર્ચા કરે છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર મુનિઓના વેશ અને આચાર, જિનેશ્વરહેવસવર્પ, ઈશ્વરવાદ, સર્વચારવાદ, કુવલાહૃતરવાદ, જ્વાહિનવતત્ત્વ, આત્મવાદ, પુરુષગત તરફ, પ્રમાણવાદ અને અનેકાન્તવાદનું વિસ્તારથી નિર્પણ કરવામાં આવેલ છે અને તે સ્થાને વિરોધી વાદોનો નીરાસ પણ સવિસ્તર કર્યો છે. તેથી જૈનદર્શનને સમજવા આ અનુવાદ અનિ ઉપ્યોગી છે.

દર્શનના અભ્યાસીઓને ઉપ્યોગી જીવાં પૂર્વ પંડિતજીએ કરેલાં આ એ મોટાં કાર્યોનું સમરથ કરી હું તેમને મારી ભાવપૂર્વક ગાનાજલિ અપુર્ણ છું. આભાર.